

## વિશ્વ ચકલી દિવસની ઉજવણી ૨૦૨૨

આણંદ કૃષિ યુનિવર્સિટીના પક્ષીશાસ્ત્ર વિભાગ, આણંદ નગર પ્રાથમિક શાળા નં. ૩, ખેતીવાડી, જહાંગીરપુરા પ્રાથમિક શાળા અને પે.સેન્ટર શાળા હાડગુડના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૯/૦૩/૨૦૨૨ ના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવેલ. જે અંતર્ગત પક્ષી વિભાગના સહ- સંશોધન વૈજ્ઞાનિક અને વડા ડૉ. સી. કે. બોરડનાં માર્ગદર્શન હેઠળ મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. જે. જી. દુવેરા તથા શ્રી. આશિષ નાયી દ્વારા શાળાનાં બાળકોને ચકલીઓના જીવન ચક્ર વિશે તથા તેની વર્તણુક અને સતત ઘટતી જતી ચકલીઓની વસ્તી પાછળનાં કારણો અને તેના સંરક્ષણ માટેનાં ઉપાયો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ. આ ઉપરાંત પુંઠામાંથી તૈયાર કરેલ માળા તેમજ માટીનાં માળા, બર્ડ ફિડર વિશે તથા ઘરે પડેલાં નકામાં પુંઠાનાં ખોખા માંથી કઈ રીતે આપણે ચકલી માટે માળા તૈયાર કરી શકીએ અને નકામી પાણીની પ્લાસ્ટીકની બોટલ માંથી કઈ રીતે બર્ડ ફિડર તૈયાર કરી શકાય તે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. જે. જી. દુવેરા, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવેલ. આણંદ નગર પ્રાથમિક શાળા નં. ૩, ખેતીવાડીના આચાર્ય શ્રીમતી કલ્પના મેકવાન, જહાંગીરપુરા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી. મીતેશભાઈ મેકલીન તથા પે.સેન્ટર શાળા હાડગુડ ના આચાર્ય શ્રી. હિરેનભાઈ મેકવાન દ્વારા પણ બાળકોને "ચકલી બચાવો" અભિયાન અંતર્ગત માર્ગદર્શન આપી કાર્યક્રમમાં સહકાર આપ્યો હતો. પક્ષી વિભાગના શ્રી. વીરેન્દ્ર જાદવ, શ્રી. રમેશ યાવડા તથા શ્રી. કમલ વસાવાએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર વિવિધ પ્રવૃત્તિઓમાં મદદ કરી કાર્યક્રમ ને સફળ બનાવવા મદદ કરેલ.

### કાર્યક્રમ ની ઝાંખી



જહાંગીરપુરા પ્રાથમિક શાળામાં માટીના માળા નું વિતરણ



ડૉ. જે. જી. દુવેરા દ્વારા વિશ્વ ચકલી દિવસ પર વિસ્તૃત વ્યાખ્યાન



વિશ્વ ચકલી દિવસની ઉજવણીમાં ભાગ લેનાર આણંદ નગર પ્રાથમિક શાળા નં. ૩, ખેતીવાડીના વિદ્યાર્થી ગણ



વિશ્વ ચકલી દિવસની ઉજવણીમાં ભાગ લેનાર જહાંગીરપુરા પ્રાથમિક શાળા વિદ્યાર્થી ગણ



વિશ્વ ચકલી દિવસની ઉજવણીમાં ભાગ લેનાર પે.સેન્ટર શાળા હાડગુડના વિદ્યાર્થી ગણ



પે.સેન્ટર શાળા હાડગુડના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને માટીના માળા નું વિતરણ



આણંદ નગર પ્રાથમિક શાળા નં. ૩, ખેતીવાડીમાં માળાનું વિતરણ



આણંદ નગર પ્રાથમિક શાળા નં. ૩, ખેતીવાડીમાં શિક્ષકોમાં માળાનું વિતરણ